



(Formerly known as Intercontinental Leasing & Finance Company Limited)

CIN: L24100GJ1984PLC111413

Reg. Office : 501, Aditraj Arcade, Near Hetvi Tower, Opp. Titanium City Center, 100 Ft. ring road, Satellite, Ahmedabad -380015.

18<sup>th</sup> September, 2020

To,

Listing Compliances, <b>BSE Limited,</b> P. J. Towers, Fort, Mumbai - 400001. <b>Scrip Code: 539938; Scrip Id: MIL</b>	Listing Compliances, <b>CSE - India,</b> 7, Lyons Range, Dalhousie Kolkata - 700001.
---	---

**Sub: Newspaper Clipping of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter ended 30<sup>th</sup> June, 2020.**

Dear Sir / Ma'am,

We hereby wish to inform you that the Unaudited financial results (Standalone & Consolidated) for the quarter ended 30<sup>th</sup> June, 2020 were approved at the meeting of Board of Directors held on 15<sup>th</sup> September, 2020.

In continuation to the same, the newspaper clipping duly published in English Newspaper and Gujarati Newspaper is enclosed herewith.

This is for your information and records.

Thanking You,

**For, Medico Intercontinental Limited**

*(formerly known as Intercontinental Leasing and Finance Company Limited)*

**Puneeta Sharma**  
**Company Secretary & Compliance Officer**



Encl: As stated

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30<sup>TH</sup> JUNE, 2020**

Particulars	₹ in Lakh (Except EPS)		
	QUARTER ENDED (Un-Audited) 30.06.2020	QUARTER ENDED (Un-Audited) 30.06.2019	YEAR ENDED (AUDITED) 31.03.2020
Total Income from operations (net)	1,314.08	3,632.92	15,012.92
Net Profit / (Loss) from ordinary activities before tax, Exceptional and/or Extraordinary items.	(307.17)	123.99	741.24
Net Profit / (Loss) from ordinary activities for the period before tax after Exceptional and/or Extraordinary items.	(307.17)	123.99	741.24
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items).	(222.64)	88.45	533.66
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (After Tax) and Other comprehensive income (After Tax)]	(223.33)	81.61	506.66
Paid-up equity share capital (Face Value of Rs. 10/- each)	571.34	571.34	571.34
Reserves (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	As on 31st March 2020		1,902.69
Earnings Per Share (of Rs. 10/-each) -			
1. Basic: (Rs.)	(3.90)	1.55	9.34
2. Diluted: (Rs.)	(3.90)	1.55	9.34

**Notes:**  
 1. The financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meetings held on 15<sup>th</sup> September, 2020. The financials results are prepared in accordance with the Indian Accounting Standard (IndAS) as prescribed under section 133 of the Companies Act, 2013, and other recognised accounting practices and policies to the extent applicable.  
 2. The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the Quarter 30<sup>th</sup> June, 2019 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly & Annual Financial Results is available on the website of the Company i.e. www.remsons.com and on the website of BSE Ltd. i.e. www.bseindia.com and National Stock Exchange of India Ltd. (www.nseindia.com).

For REMSONS INDUSTRIES LIMITED  
 KRISHNA KEJRIWAL  
 CHAIRMAN & MANAGING DIRECTOR  
 DIN - 00513788  
 Place : Mumbai  
 Dated : 15<sup>th</sup> September, 2020

**VAMA INDUSTRIES LIMITED**  
 CIN: L72200TG1985PLC041126  
 Regd. Off. Ground Floor, 8-2-248/1/7/78/12.13, Block-A, Lakshmi Towers, Nagarjuna Hills, Punjagutta, Hyderabad - 500082  
 Phone No. +91-40-6684 5534, Fax No. +91-40-23355821  
 Email id: investorservices@vama.co.in, Website: www.vamaind.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter Ended 30<sup>th</sup> June 2020 (Rs in Lakhs)

S. No	Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
		30.06.2020	31.03.2020	30.06.2019
1	Total income from operations (net)	456.04	740.15	1,087.88
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(12.93)	4.81	69.75
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(12.93)	4.81	69.75
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(13.56)	(1.51)	60.17
5	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(13.56)	(1.51)	60.17
6	Equity Share Capital	1,050.80	1,050.80	1,050.80
7	Earnings Per Share (of Rs. 2/- each) for continuing and discontinued operations			
	Basic:	(0.03)	-	0.11
	Diluted:	(0.03)	-	0.11

**Notes:**  
 1. Summarised unaudited standalone financial results of the company is as under

S. No	Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
		30.06.2020	31.03.2020	30.06.2019
1	Total income from operations	212.99	435.04	522.90
2	Net profit before tax	(17.75)	(19.19)	16.22
3	Net profit after tax	(17.89)	(23.11)	12.90

2. The financial results have been reviewed by the audit committee of the Board and approved by the Board of Directors at their meeting held on 15<sup>th</sup> September, 2020.  
 3. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on company's website at www.vamaind.com and the stock exchange's website www.bseindia.com

For Vama Industries Limited  
 Sd/- V. Alchutha Rama Raju  
 Managing Director, DIN: 00997493  
 Date: 15.09.2020  
 Place: Hyderabad

**RAJPUTANA INVESTMENT & FINANCE LIMITED**  
 Regd. Office: "Nanda Tower", 90 Phears Lane, Room No.601, 6th Floor, Kolkata - 700 012, CIN - L65929WB1941PLC010731  
 STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30<sup>TH</sup> 2020 (₹ In Lacs)

PARTICULARS	Quarter Ended		
	30.06.20 (Un-Audited)	31.03.20 (Audited)	30.06.19 (Un-Audited)
1. Total income from Operations	4.81	18.68	5.59
2. Net Profit / (Loss) for the Period Before Tax (Before Exceptional and/or Extraordinary items)	(1.49)	0.74	2.34
3. Net Profit / (Loss) for the Period Before Tax (After Exceptional and/or Extraordinary items)	1.49	0.74	2.34
4. Net Profit / (Loss) for the Period After Tax (After Exceptional and/or Extraordinary items)	(1.49)	0.74	2.34
5. Total Comprehensive Income for the Period (Comprising Profit / (Loss) for the period (After Tax) and other comprehensive Income (After Tax))	(1.49)	0.74	2.34
6. Reserve as shown in the Audited Balance sheet of the previous year		0.69	
7. Earnings Per Share (of ₹ 10/- each)			
(a) Basic	(0.05)	0.02	0.08
(b) Diluted	(0.05)	0.02	0.08

**NOTES:**  
 1. The above is an extract of the detailed format of first quarter ended June 30, 2020 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format for the year ended June 30, 2020, financial results is available on the websites of the Stock Exchange(s).  
 For Rajputana Investment & Finance Limited  
 Sd/-  
 Mathew Jose  
 (Director)  
 Place : Kolkata  
 Dated : 15 August, 2020  
 DIN: 00542339

**MEDICO INTERCONTINENTAL LIMITED**  
 (formerly known as Intercontinental Leasing and Finance Company Limited)  
 CIN: L24100GJ1984PLC111413  
 Regd. Office: 1-5th Floor, Adit Raj Arcade, Nr Karma Shreshtha Tower, 100 Ft Rd, Satellite, Ahmedabad, Gujarat - 380015  
 Phone: 079 2674 2739  
 Email: mail@medicointercontinental.com Website: www.medicointercontinental.com

Extracts of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30<sup>th</sup> June, 2020. (Amt. in Lakhs except for the EPS)

Particulars	Standalone			Consolidated		
	Quarter ended 30.06.2020 (Unaudited)	Previous Year ended 31.03.2020 (Audited)	Corresponding 3 months ended in previous year on 30.06.2019 (Unaudited)	Quarter ended 30.06.2020 (Unaudited)	Previous Year ended 31.03.2020 (Audited)	Corresponding 3 months ended in previous year on 30.06.2019 (Unaudited)
	Total income from operations (net)	1378.20	4895.73	986.48	1999.28	8201.47
Net Profit/(Loss) for the period (before tax and exceptional items)	42.01	153.62	39.48	88.76	320.18	78.64
Net Profit/(Loss) for the period before tax (after exceptional items)	42.01	153.62	39.48	88.76	320.18	78.64
Net Profit / (Loss) for the period after tax	31.65	111.84	29.22	66.53	235.68	58.58
Total Comprehensive Income for the period	31.65	111.84	29.22	66.53	235.68	58.58
Paid-up Equity Share Capital (Share of Rs. 10/- each)	324.90	324.90	324.90	324.90	324.90	324.90
Earning per equity share						
Basic	0.97	3.44	0.90	2.05	7.25	1.80
Diluted	0.97	3.44	0.90	2.05	7.25	1.80

**Note:**  
 The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results along with Limited Review Report for the quarter ended is available on the website of the Stock Exchange (www.bseindia.com) and on the website of the Company (www.medicointercontinental.com).  
 The above financial results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at the meeting held on September 15, 2020. The Statutory Auditor has carried out a limited review of the aforesaid financial results as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended. The Financial Results of the Company has been prepared in accordance with Indian Accounting Standards (IND AS) notified under the Companies (Accounting Standards) Rules, 2015 as amended by the Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2016 and other accounting principles generally accepted in India.  
 As a result of the nationwide lockdown imposed by the Government of India (GOI) due to outbreak of Covid-19 Pandemic, the business operations of the Company were temporarily disrupted at its various trading and distribution locations impacting production and sales from the second half of March 2020. Since then, the operations have been gradually resuming in line with the GOI directives issued in this regard. The Company has informed the impact of Covid-19 to the stock exchanges from time to time. The management has considered the possible effects that may result from the pandemic on the recoverability/carrying value of its assets which does not have any significant impact on carrying value of its assets. The impact of Covid-19 on the Company's financial statements in future may differ from that estimated as at the date of approval of these financial results.  
 For Medico Intercontinental Limited  
 Sd/-  
 Samir Shah  
 Managing Director  
 DIN: 03350268  
 Date: 15/09/2020  
 Place: Ahmedabad

**GOGIA CAPITAL SERVICES LIMITED**  
 CIN: L74899DL1994PLC059674  
 Regd. Office:- 100A/1 Right Wing, The Capital Court Ground Floor, Shopping centre, Munirka-III New Delhi 110067  
 Email:- accounts@gogiacap.com, Website:- www.gogiacap.com, Contact no: 011-49418888

Extract of Un-audited standalone financial results for the quarter ended on 30th June, 2020 (Figures in Lakhs)

S. NO	Particulars	30.06.2020	30.06.2019	31.03.2020	31.03.2020
		Quarter Unaudited	Quarter Unaudited	Quarter Audited	Year ended Audited
1	Total Income from Operations	151.35	191.59	248.99	847.70
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	73.02	98.16	153.48	522.51
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	73.02	98.16	153.48	522.51
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	55.40	78.36	107.98	377.01
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	55.40	78.36	107.98	377.01
6	Equity Share Capital	632.11	632.11	632.11	632.11
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	3428.86
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
	1. Basic:	0.88	1.24	1.71	5.96
	2. Diluted:	0.88	1.24	1.71	5.96

**Notes:-**  
 1) The above un-audited standalone financial results have been reviewed by the audit Committee and approved by the Board of Directors in their meeting held on 15th September, 2020. These results have been subject to "Limited Review" by the statutory auditors of the company.  
 2) The above is an extract of the detailed format of un-audited standalone financial results filed with the stock exchange under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited standalone financial results are available on the website of the company and at stock exchange www.bseindia.com.  
 For Gogia Capital Services Limited  
 Sd/-  
 Satish Gogia  
 Managing Director  
 Place: Delhi  
 Date: 15.09.2020

**TCI FINANCE LIMITED**  
 Regd Office: Plot No 20, Survey No 12, 4th Floor, Kothaguda, Kondapur, Hyderabad - 500081. CIN: L65910TG1973PLC031293. www.tcofi.in  
 Phone No : 040-71204284 & Fax No : 040-23112318

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2020 (₹ IN LAKHS)

PARTICULARS	QUARTER ENDED 30-06-2020 Unaudited	QUARTER ENDED 30-06-2019 Audited	QUARTER ENDED 30-06-2019 Unaudited	YEAR ENDED 31-03-2020 Audited
	Total income from operations (Net)	172	145	81
Net Profit / (Loss) from ordinary activities after tax	81	(4719)	(323)	(5232)
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	81	(4719)	(323)	(5232)
Total Comprehensive Income for the period (comprising Profit (Loss) and other Comprehensive Income for the period)	(132)	(4487)	(1719)	(8059)
Equity Share Capital	1287	1287	1287	1287
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	(5727)
Earnings Per Share (before extraordinary items) (₹ 10/- each) Earnings Per Share (before extraordinary items) (₹ 10/- each)				
Basic :	0.63	(36.67)	(2.51)	(40.64)
Diluted :	0.63	(36.67)	(2.51)	(40.64)
Earnings Per Share (after extraordinary items) (₹ 10/- each) Earnings Per Share (after extraordinary items) (₹ 10/- each)				
Basic :	0.63	(36.67)	(2.51)	(40.64)
Diluted :	0.63	(36.67)	(2.51)	(40.64)

**Notes:**  
 1) The above results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meeting held on September 15, 2020.  
 2) The above is an extract of the detailed format of Quarter ended June 30, 2020 Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended June 30, 2020 are available for investors at www.tcofi.in, www.bseindia.com & www.nseindia.com.  
 3) Refer to qualified conclusions of the statutory auditors in their review report  
 For and on behalf of the Board  
 Sd/-  
 Mahendra Kumar Agarwal  
 Director  
 (DIN: 00179779)  
 Place : Hyderabad  
 Date : 15-09-2020

**Karma Energy**  
 CIN L31101MH2007PLC168823  
 Regd. Office : Regd. Office : 214, Empire House, Dr. D. N. Road, Ent. A. K. Nayak Marg, Fort, Mumbai - 400001  
 Tel Nos : 22071501-06 Fax : 22071514 Email : investors@karmaenergy.com Visit us at : www.karmaenergy.co  
 Extract of the Un-audited Financial Results for the Quarter ended 30.06.20 (Rs. in Lac except EPS data)

Particulars	Standalone			Consolidated			
	Quarter Ended 30.06.20 Unaudited	Quarter Ended 31.03.20 Audited	Quarter Ended 30.06.19 Unaudited	Year Ended 31.03.20 Audited	Quarter Ended 30.06.20 Unaudited	Quarter Ended 31.03.20 Audited	Year Ended 31.03.20 Audited
	1 Total Income from Operations	580.30	584.84	773.02	3,686.72	715.61	637.01
2 Net Profit / (Loss) for the period before Tax	(302.93)	11.58	(91.60)	19.81	(302.49)	(106.76)	(63.72)
3 Net Profit / (Loss) for the period after Tax	(278.88)	17.49	(75.18)	17.16	(281.14)	(94.43)	(54.61)
4 Total Comprehensive Income for the period [Comprising Profits / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	(161.61)	(68.73)	(242.74)	(192.08)	(144.90)	(194.05)	(250.42)
5 Equity Share Capital	1,156.99	1,156.99	1,156.99	1,156.99	1,156.99	1,156.99	1,156.99
6 Earnings per Share of Rs. 10/- each [(for Continuing and Dis-continued Operations (not annualised)) Basic & Diluted	(2.41)	0.15	(0.65)	0.15	(2.43)	(0.82)	(0.53)

**Notes:**  
 1 The above is an extract of the detailed format of Quarterly Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for Quarter Ended 30.06.20 is available on the websites of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.karmaenergy.co  
 2 The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on 15.09.20.  
 3 The Company is primarily operating in the business of Generation of Power from Renewable Sources. Hence, there is only one business segment as per Ind-AS 108 - Operating Segments.  
 4 As required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the review by the Statutory Auditors has been completed for the Quarter 30.06.20 and the Report has been forwarded to the stock exchanges. The Report does not contain any qualification.  
 5 Previous period's figures have been regrouped / reclassified wherever necessary.  
 For KARMA ENERGY LIMITED  
 Sd/-  
 Chetan D. Mehra  
 Vice Chairman  
 DIN - 00022021  
 Place : Mumbai  
 Dated : 15.09.2020

**RCI INDUSTRIES & TECHNOLOGIES LIMITED**  
 CIN No.: L74900DL1992PLC047055  
 Regd. Off.: Unit No. 421, 4th Floor, Pearl Omaxe, Netaji Subhash Place, Pitampura Delhi-110034  
 Phone: 011-27372194, Fax : +91-11-27371334 Email: compliance@rciind.com Website: www.rciind.com  
 EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2020 (Rs. in Lakhs)

Sl. No	Particular	Standalone		Year ended	Consolidated		Year ended
		Quarter ended 30.06.2020 (Unaudited)	31.03.2020 (Audited)	30.06.2019 (Unaudited)	31.03.2020 (Unaudited)	31.03.2020 (Audited)	31.03.2020 (Audited)
		1 Total Income from operations	895.10	7,935.45	16,353.20	40,590.18	900.24
2 Net Profit/ (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	(630.35)	(5,181.70)	336.19	(10,608.00)	(1,668.24)	(7,565.31)	369.80
3 Net Profit/ Loss for the period before tax (after exceptional and/or extraordinary items)	(630.35)	(5,592.06)	(1,331.54)	(14,322.42)	(1,668.24)	(7,975.66)	(1,297.94)
4 Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	(602.61)	(5,496.66)	(1,310.17)	(14,247.67)	(1,640.51)	(7,880.48)	(1,276.57)
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(600.75)	(5,492.83)	(1,308.97)	(14,240.22)	(1,626.28)	(7,329.80)	(1,318.64)
6 Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1,567.64	1,567.64	1,343.64	1,567.64	1,567.64	1,567.64	1,343.64
7 Earnings per Share (of Re 10/- each) for continuing and discontinued operations- (a) Basic (b) Diluted	(3.84)	(35.06)	(9.75)	(90.89)	(10.46)	(50.27)	(9.50)

**Notes:**  
 1 The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Financial Result for the quarter ended 30th June, 2020 are available on the websites of the Stock Exchange www.bseindia.com and on the Company's website: www.rciind.com.  
 2 The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 15th September, 2020  
 3 During the year ended March 31, 2020, all the lenders to Company has declared the account as non performing assets (NPA) due to non payment of interest due and borrowed amount  
 4 Figures for the previous period have been re-grouped/rearranged/restated wherever necessary to make them comparable with those of the current period.  
 For RCI Industries and Technologies Limited  
 Sd/-  
 Rajeev Gupta  
 Managing Director  
 DIN: 00503196  
 PLACE :- NEW DELHI  
 DATE :- 15.09.2020

**TARAI FOODS LIMITED**  
 REGD OFFICE: 13, HANUMAN ROAD, CONNAUGHT PLACE, NEW DELHI-110001. Tel No: 011-41018839  
 CIN NO. : L15142DL1990PLC039291 WEBSITE: www.taraifoods.com Email: grvnces.tfi@gmail.com  
 EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2020 (RS. IN LACS)

Particulars	Quarter ending 30.06.2020	Preceding Quarter ending 31.03.2020	Corresponding Quarter ending 30.06.2019	Year ending 31.03.2020	Year ending 31.03.2019
	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	AUDITED

**Mangalore SEZ Limited**  
Mangalore Special Economic Zone, Sy.No. 168-3A, Plot No. U1 Administrative Building, Bajpe Village, Mangalore - 574 142 Dakshina Kannada, Karnataka. Phone: 0824-2885501/02 Fax:0824-2885503 Website: www.mangaloresez.com CIN: U45209KA2006PLC038590

**INVITATION FOR E-BIDS FOR SUPPLY OF POWER**

16.09.2020  
MANGALORE SEZ LIMITED (MSEZL), a deemed distribution licensee under Electricity Act, 2003 for supply of power at Mangalore Special Economic Zone, invites e-bids for selection of seller for supply of 2 MW power on short term basis for a period of 6 months through E-Tendering and E-Reverse Auction process.

The RFP documents for participation can be downloaded through DEEP E-portal of [www.mstcecommerce.com](http://www.mstcecommerce.com)

Sd/-, Chief Executive Officer  
Mangalore SEZ Ltd, Mangalore

**Super Crop Safe Limited**  
CIN: L24231GJ1987PLC009392  
Regd. Office: C-1/290, GIDC Estate, Phase I, Naroda, Ahmedabad-382330  
Phone: 079-22823907, Email: [super\\_crop\\_safe@yahoo.com](mailto:super_crop_safe@yahoo.com), Website: [www.supercropsafe.com](http://www.supercropsafe.com)

**Extract of Un Audited Financial Results for the quarter ended 30th June, 2020 Standalone**

Particulars	Quarter ended		Corresponding 3 months in preceding year
	30-06-2020	30-06-2019	
Total Income from operations (net)	917.97	1417.32	
Net Profit/(Loss) from ordinary activities after tax	-38.22	139.25	
Net Profit/(Loss) for the period after tax (after extra ordinary items)	-148.58	113.11	
Total Comprehensive Income for the Period after tax [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-37.79	114.19	
Equity Share Capital	804.29	790.49	
Reserves (Excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	2862.14	2679.18	
Earning per share (before extraordinary items) (of Rs. 2/- each)			
Basic:	-0.09	0.29	
Diluted:	-0.09	0.29	
Earning per share (after extraordinary items) (of Rs. 2/- each)			
Basic:	-0.09	0.29	
Diluted:	-0.09	0.29	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website, [www.bseindia.com](http://www.bseindia.com) and Company's website [www.supercropsafe.com](http://www.supercropsafe.com)

Place: Ahmedabad  
Date: 15th September, 2019

For, Super Crop Safe Ltd  
Sd/- Hiral Patel  
Company Secretary

**MADHYA BHARAT PAPERS LIMITED**  
Regd. Office : Village Birgahni, Rly & Post Champa-495671, Dist. Jangir-Champa (C.G.)  
CIN:L21012CT1980PLC001682  
www.mbppl.in, E-mail: [info@mbpl.in](mailto:info@mbpl.in), Tel: (078119) 245055

**EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2020**

Sl. No.	Particulars	Quarter Ended		Year ended
		30.06.2020 (Unaudited)	31.03.2020 (Audited)	
1	Total Income from operations	-	2.62	744.19
2	Net Profit/(Loss) for the period (before tax and Exceptional item)	(144.28)	(74.43)	(302.89)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional item)	(144.28)	(74.43)	(302.89)
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional item)	(144.28)	(74.43)	(302.89)
5	Total Comprehensive Income for the period (Comprising Profit and other Comprehensive Income for the period)	(137.19)	(60.40)	(298.11)
6	Equity Share Capital (Face value Rs. 10/-)	341.00	341.00	341.00
7	Reserves (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of the previous year)	NA	NA	NA
8	Earning per Share (of Rs. 10/- each)			
	(i) Basic (Rs.)	(4.23)	(2.18)	(8.88)
	(ii) Diluted (Rs.)	(4.23)	(2.18)	(8.88)

Note: 1. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website ([www.mbppl.in](http://www.mbppl.in)).

2. The above Unaudited standalone financial results of the company for the quarter ended June 30, 2020 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on 15th September, 2020

For and on behalf of the Board  
Jaydeep Chittlangia  
Managing Director  
(DIN: 00094002)

Place of Signature : Kolkata  
Date : 15th September, 2020

**LCINFOTECH LIMITED**  
CIN:L2200WB1965PLC073196  
Regd Office: P-16, C. T. Road, Kolkata-700014  
Corporate office: 25A Sarat Bose Road, Kolkata-20  
Ph: 033-40033636/37, Fax: 033024852932  
Email: [corporate@lccinfotech.co.in](mailto:corporate@lccinfotech.co.in), Website: [www.lccinfotech.in](http://www.lccinfotech.in)

**Extract of Standalone and Consolidated Financial Result for the Qtr. ended on 30/06/2020**

Particulars	Standalone				Consolidated			
	Qtr ended on 30/06/20 (Un-Audited)	Qtr ended on 31/03/20 (Audited)	Qtr ended on 30/06/19 (Un-Audited)	Year ended on 31/03/20 (Audited)	Qtr ended on 30/06/20 (Un-Audited)	Qtr ended on 30/06/19 (Un-Audited)	Year ended on 31/03/20 (Audited)	Year ended on 31/03/20 (Audited)
Total Income from Operations	1.32	56.40	50.70	430.58	1.32	56.40	50.70	430.58
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(8.02)	(2.11)	0.39	(2.79)	(8.02)	(2.73)	0.39	(3.41)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(8.02)	(2.11)	0.39	(2.79)	(8.02)	(2.73)	0.39	(3.41)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(8.02)	(2.11)	0.39	(2.79)	(8.02)	(2.73)	0.39	(3.41)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(8.02)	(2.11)	0.39	(2.79)	(8.02)	(2.73)	0.39	(3.41)
Equity Share Capital	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				3370.66				3335.12
Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued operations)								
1. Basic:	(0.0063)	(0.0017)	0.0003	(0.0022)	(0.0063)	(0.0022)	0.0003	(0.0027)
2. Diluted:	(0.0063)	(0.0017)	0.0003	(0.0022)	(0.0063)	(0.0022)	0.0003	(0.0027)

The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.

Place : Kolkata  
Date: 14th Sep 2020

**મેડિકો ઇન્ટરકોન્ટીનેન્ટલ લીમીટેડ**  
(અગાઉ ઇન્ટરકોન્ટીનેન્ટલ લીમીટેડ એન્ડ સુપર કોન્ટિનન્ટલ લીમીટેડ તરીકે જાણીતી)  
CIN : L24100GJ1984PLC111413

રજીસ્ટર્ડ ઓફીસ: ૧-૫મો માળ, અદિત રાજ આર્કેડ, કમો શ્રેષ્ઠ ટાવર પાસે, ૧૦૦ રુટ કોર્ટ, સેટેલાઈટ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫ ફોન : ૦૭૯ ૨૬૬૭૨૭૩૯  
ઇમેઇલ : [mail@medicointercontinental.com](mailto:mail@medicointercontinental.com) વેબસાઇટ : [www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)

૩૦ જૂન, ૨૦૨૦ ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગણના અનર્ગોડિટેડ અલાયદા અને સંયુક્ત નાણાકીય પરિણામોનો સાર

વિગતો	અલાયદા		સંયુક્ત	
	રૂ. મા. નાં ૩૦.૦૬.૨૦૨૦ અનર્ગોડિટેડ	પાછલા વર્ષનાં ૩૧.૦૩.૨૦૨૦ ઓડિટેડ	રૂ. મા. નાં ૩૦.૦૬.૨૦૧૯ અનર્ગોડિટેડ	પાછલા વર્ષનાં ૩૧.૦૩.૨૦૨૦ ઓડિટેડ
કામચાંદની કુલ આવક (ચોખ્ખી)	૧૩૦૮.૨૦	૪૬૯૫.૭૩	૯૮૬.૪૮	૧૯૯૯.૪૩
આવનો ચોખ્ખો નફો/ખોટ (વેરા, અચાલકુલ વીજો પેમેન્ટ)	૪૨.૦૧	૧૧૩.૬૨	૩૯.૪૮	૮૮.૭૬
વેરા ચૂકવેલા ચોખ્ખો નફો/ખોટ (અસાધ્ય વીજો પેમેન્ટ)	૪૨.૦૧	૧૧૩.૬૨	૩૯.૪૮	૮૮.૭૬
વેરા વાળી આવનો ચોખ્ખો નફો /ખોટ	૩૧.૬૫	૧૧૧.૮૪	૨૯.૨૨	૬૬.૫૩
આવનો કુલ સંયુક્ત આવક	૩૧.૬૫	૧૧૧.૮૪	૨૯.૨૨	૬૬.૫૩
ભારતીય ધરને ઉઠાવેલી શેર મુતી (પ્રતિબદ્ધ રૂ. ૧૦/-ની)	૩૨૪.૯૦	૩૨૪.૯૦	૩૨૪.૯૦	૩૨૪.૯૦
ઉઠાવેલી શેરો/કમ્પાઉન્ડ મુતી	૦.૬૭	૩.૪૪	૦.૬૦	૨.૦૫
મુખ્ય	૦.૬૭	૩.૪૪	૦.૬૦	૨.૦૫
ધરોહરી	૦.૬૭	૩.૪૪	૦.૬૦	૨.૦૫

નોંધ :  
સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલ અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો વિગતવાર માહિતીનો સાર ઉપર મુજબ છે. વિગતવાર માહિતી માટે પસંદગી કરવામાં આવેલા સંયુક્ત નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ઓફિસ ડિપાર્ટમેન્ટ ડીવાઇસર નિયમો અને ભાગલાઈ કરવામાં આવેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.bseindia.com](http://www.bseindia.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડિટેડ નાણાકીય પરિણામોનો સાર ઓફિસ વેબસાઇટ ([www.medicointercontinental.com](http://www.medicointercontinental.com)) પર ઉપલબ્ધ છે.  
ફોન : ૧૯ માસમાં સેનો (ફિલિપાઇન અને અન્ય ડિસ્ટ્રિક્ટોર ડીવાઇસર) નિયમો, ૨૦ ૧૫ ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં કાયમ કરેલા અનર્ગોડ